



લોન અરજી ફોર્મ

(કેપટલ અકષરોમાં ભરવાનું)

અરજીની તારીખ

DDMMYYYY

પસંદગીની ભાષા

English

हिन्दी

ગુજરાતી

বাংলা

मराठी

ગુજરાતી

বাংলা

मराठी

અરજદારનો
તાજેતરનો
ફોટોગ્રાફ
લગાવો

લોનની રકમ	લોનની મુદત (મહિનામાં)	વ્યાજ દર	સહ-અરજદારોની સંખ્યા
લોન ઉત્પાદન	લોનનો ઉદ્દેશ્ય	વ્યાજનો દર	નિશ્ચિત
લોન વ્યવહારનો પ્રકાર	બેલેન્સ ટ્રાન્સફર	બાકી લોનની રકમ (બેલેન્સ ટ્રાન્સફરના કિસ્સામાં)	
લોનનો પ્રકાર	ઓવરડ્રાફ્ટ		
લોનનો હેતુ	વ્યવસાય	હાઉસિંગ	વ્યક્તિગત, કૃપા કરીને સ્પષ્ટ કરો

હાલના AFL ગ્રાહક ID	CKYC નંબર.
સંપૂર્ણ / એન્ટિટી નામ	શીર્ષક
જન્મ તારીખ / સ્થાપના તારીખ (કંપનીના કિસ્સામાં)	માતાનું પ્રથમ નામ
ધર્મ	વિકલાંગ વ્યક્તિ
પ્રતિબંધના પ્રકાર	પ્રતિબંધનું ટકા
યુડીઆઈડી કાર્ડ (અનન્ય વિકલાંગ ઓળખ પત્ર)	
નિવાસ સ્થિતિ	નિવાસનો દેશ
વગર	આશ્રિતોની સંખ્યા
વૈવાહિક સ્થિતિ	લિંગ
સંપર્ક વિગતો	

દસ્તાવેજ	સબમિટ કરેલ	ID નંબર	વર્તમાન સરનામું	ટપાલ સરનામું	આઈડી (ID) પ્રૂફ
આધાર કાર્ડ		ફક્ત છેલ્લા ૪ અંકો			
પાન કાર્ડ					
પાસપોર્ટ					
ડ્રાઇવિંગ લાઇસન્સ					
મતદાર ID કાર્ડ					
NREGA(નરેગા)					
રાષ્ટ્રીય વસતી રજિસ્ટર - પત્ર					

વ્યક્તિગત અરજદારો સહાયના અરજદારો માટે વધારાની માહિતી					
ઉદ્યમ રજી. પ્રમાણપત્ર	ઉદ્યમ				
પાન કાર્ડ (એન્ટ્રીટી)					
બંધારણનો પુરાવો (CIN/LLPIN/DPIN/DIN/TIN/NIC કોડ)					
જી.એસ.ટી (GST) નોંધણી					
કુકાનો અને સ્થાપના પ્રમાણપત્ર					
યુટિલિટી બિલ્સ (CA નંબર)					
વર્તમાન સરનામું	લેન્ડમાર્ક	શહેર	રાજ્ય	પિન	રહેતા હોવાથી

ટપાલ સરનામું																	રહેતા હોવાથી						
																	M M Y Y						
	લેન્ડમાર્ક								શહેર														
રાજ્ય								પિન															

રોજગારની વગિતો

સંસ્થાનું નામ																																
હોદ્દો	VISITING CARD FRONT																VISITING CARD BACK															
ઓફિસ ઇમેઇલ આઇડી																	સંપર્ક વિગતો															
રોજગાર પૂરકી																મોબાઇલ _____ ફોન _____																
લાયકાત																અનુભવ વતરુમાન ઉદ્યોગમાં કુલ વર્ષો Y Y કુલ કાયર અનુભવ Y Y																
વ્યવસાય બંધારણ																અસચેસસી એચએસસી ડિપ્લોમા ઉપસ્નાતક સ્નાતક અનુસ્નાતક પુરોજ્ઞાનલ																
ઉદ્યોગ પ્રકાર																જાહેર લિમિટેડ ખાનગી લિમિટેડ બહુરાષ્ટ્રીય કંપની ભાગીદારી એકમાલિકી એલએલપી અન્ય																
વ્યવસાય ક્ષેત્રનો પ્રકાર																વેપાર ઉત્પાદન સેવાઓ અન્ય માસિક ચોખ્ખી આવક (લાખમાં)																
																રેલ્વે સ્ટેશન / બસ સ્ટેન્ડ બજાર / મોલ રહેણાંક ઔદ્યોગિક શહેરની બહાર/અવિકસિત																

સંદર્ભ વગિતો

	પ્રાથમિક બેંક																અન્ય બેંક															
બેંક																																
શાખા																																
આઈએફએસસી																																
એ/સી પ્રકાર	બચત ખાતું ચાલુ ખાતાની ઓવરડ્રાફ્ટ રોકડ જમા																બચત ખાતું ચાલુ ખાતાની ઓવરડ્રાફ્ટ રોકડ જમા															
બેંક ખાતા નંબર																																

સક્રિય ક્રેડિટ કાર્ડની સંખ્યા		સક્રિય લોનની સંખ્યા		ઘર લોન		ઓટો		વ્યક્તિગત લોન		મિલકત સામે લોન		વ્યવસાય લોન		ઓવરડ્રાફ્ટ		કાર્યકારી મૂડી
-------------------------------	--	---------------------	--	--------	--	-----	--	---------------	--	----------------	--	-------------	--	------------	--	----------------

બેંક અને લોનની વગિતો

	સંદર્ભ ૧																સંદર્ભ ૨															
નામ																																
સંબંધ																																
સરનામું	રાજ્ય પિન																રાજ્ય પિન															
મોબાઇલ નંબર																																

અરજી ફી

ચુકવણીની પદ્ધતિ	અગાઉથી આંશિક અગાઉથી અરજી ફી ચેકની તારીખ D D M M Y Y Y Y															
ચેક નંબર	આઈએફએસસી એમઆઈસીઆર															
બેંકનું નામ	બેંક એકાઉન્ટ															

સોર્સગિ વગિતો (ઓફિસ ઉપયોગ માટે)

ચેનલ	ડીલર ડીએસએ શાખા કનેક્ટર ડાયરેક્ટ શાખા સોલ આઈડી															
એએસએમ (ASM) કર્મચારીનું નામ	એએસએમ (ASM) કર્મચારી કોડ															
એસએમ કર્મચારી નામ	એસએમ કર્મચારી કોડ															
એસઓ કર્મચારી નામ	એસઓ કર્મચારી કોડ															
LG / DSA / કનેક્ટરનું નામ	LG / DSA / કનેક્ટરનું કોડ															
ચોજના																

ગ્રાહક ઘોષણા

હું/અમે Axis Finance Limited (“AFL”) પાસે લોન માટે અરજી કરી છે. હું/અમે આ દ્વારા પ્રતિબદ્ધતા, જાહેરાત, સંમતિ અને ખાતરી આપું છું/અપીએ છીએ કે - ૧. હું/અમે સમજી શકીએ છીએ કે મેં/અમે જે લોન માટે અરજી કરી છે તેની રિસ્ક ગ્રેડેશન અને વ્યાજદર લોનની રકમ, અવધિ, ડાઉન પેમેન્ટ, આપેલી સુરક્ષા/કલેટરલ, જોખમના પરિમાણો, બજારની સ્થિતિ, ફંડનો ખર્ચ, AFL સાથેનો લોન ઇતિહાસ, ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની દ્વારા અપાયેલ ક્રેડિટ સ્કોર, મારી/અમારી ઉમર, આવક અને લોન મૂલ્યાંકન માટે જરૂરી અન્ય માહિતી પર આધારિત રહેશે. હું/અમે જાણીએ છીએ કે લોન પર લાગુ પડતા સામાન્ય વ્યાજદર અને અન્ય ચાર્જ AFL ની વેબસાઇટ (https://www.axisfinance.in) પર ઉપલબ્ધ છે।૩. હું/અમે સ્વીકારું છું/સ્વીકારીએ છીએ કે લોન અરજી, લાગુ પડતા ચાર્જનું સમયપત્રક અને લોન પ્રક્રિયા માટેની દસ્તાવેજી જરૂરિયાતો Axis Finance સાથે જમા કરવામાં આવી છે।૪. અરજી સાથે આપેલી તમામ માહિતી, નાણાકીય દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ, માલિકીના કાગળો/કાનૂની દસ્તાવેજો અને અન્ય વિગતો અથવા AFL પ્રતિનિધિ દ્વારા ભરાયેલ મોબાઇલ/ટેબ એપ આધારિત ફોર્મ સંપૂર્ણપણે સાચી, અપડેટ અને સત્ય છે, અને કોઈ માહિતી છુપાવવામાં આવી નથી। મારી/અમારી દ્વારા આપવામાં આવેલી માહિતી, જેમાં સંવેદનશીલ વ્યક્તિગત માહિતીનો સમાવેશ થાય છે, AFL ના ક્રેડિટ મૂલ્યાંકન માટેનો આધાર હશે, અને AFL પોતાની સ્વેચ્છાથી લોન કે સેવા મંજૂર કરવાની શક્તિ ધરાવે છે।પ. જો કોઈ દસ્તાવેજ કે માહિતીમાં તફાવત કે અસંગતિ જોવા મળે, તો AFL ને કોઈ પણ તબક્કે મંજૂરી રદ કરવાની કે પહેલેથી જ વિતરણ કરેલી લોન પાછી બોલાવવાની સંપૂર્ણ છૂટ રહેશે।૬. હું/અમે જાહેર કરીએ છીએ કે AFL અથવા અન્ય કોઈ બેંક/નાણાકીય સંસ્થામાંથી લીધેલી લોનમાં હું/અમે ક્યારેય ડિફોલ્ટર નથી રહ્યા।૭. મારી/અમારી વિરુદ્ધ કોઈ અદાલત કે સત્તાધિકારીએ કરાર ભંગ, કરચોરી અથવા અન્ય કોઈ ગુનાહિત કૃત્ય માટે કોઈ આદેશ, ડિક્રી કે ચુકાદો આપ્યો નથી, જે મારી/અમારી લોન ચૂકવવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે।૮. મારી/અમારી વિરુદ્ધ કોઈ દિવાળિયાપણાની કાર્યવાહી, બાકી વસૂલાતની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી અથવા કંપની વિસર્જન, પુનઃગઠન કે લિક્વિડેશન સંબંધિત કાર્યવાહી ચાલી રહી નથી અને હું/અમે ક્યારેય અદાલત દ્વારા દિવાળિયા જાહેર થયા નથી।૯. હું/અમે AFL અને તેના સહયોગી સંસ્થાઓના કર્મચારીઓને માહિતી એકત્રિત, આપ-લે, શેર કે હિસ્સો કરવા માટે મંજૂરી આપું છું/અપીએ છીએ, ક્રોસ સેલિંગ અથવા રેફરલ હેતુસર।૧૦. હું/અમે સ્વીકારું છું/સ્વીકારીએ છીએ કે AFL ને લોન અરજી સ્વીકારવા કે નકારી દેવાનો સંપૂર્ણ અધિકાર છે, અને આવા નકાર માટે કે વિલંબ માટે AFL મારી/અમારી સામે કોઈ જવાબદારી ધરાવતું નથી। લોનની રકમ સંપૂર્ણપણે AFL ના નિર્ણય પર નિર્ભર રહેશે, અને AFL એ મારી/અમારી સામે કોઈ વચન આપેલું નથી।૧૧. AFL પોતાની સ્વેચ્છાથી લોનની રકમ નક્કી કરશે અને એ બાબતે કોઈ પ્રતિબદ્ધતા આપી નથી।૧૨. એક વખત ચૂકવેલ રજીસ્ટ્રેશન/પ્રોસેસિંગ ફી અથવા અન્ય કોઈ ફી AFL કોઈ પણ પરિસ્થિતિમાં પરત આપવાની ફરજ પાડવામાં આવતી નથી।૧૩. સ્ટેમ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી, કાનૂની ફી, મૂલ્યાંકન ચાર્જ, ROC ફાઇલિંગ ચાર્જ (જો લાગુ પડે) અને અન્ય વાસ્તવિક ખર્ચો હું/અમે જાતે જ ભરશું।૧૪. હું/અમે સમજી શકીએ છીએ કે AFL ની જરૂરી દસ્તાવેજી તપાસ, મૂલ્યાંકન અને નિયમોના સંતોષકારક પાલન પછી જ લોન વિતરણ કરવામાં આવશે।૧૫. અરજીમાં કે પછી આપેલી કોઈ માહિતીમાં ફેરફાર થાય, જેમ કે સરનામું, રોજગાર, વ્યવસાય, આવક કે ફોન નંબર, તો AFL ને તરત જ જાણ કરવામાં આવશે।૧૬. હું/અમે AFL ને સહકાર આપીશ/અપીએ છીએ અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડીશ/અપીએ છીએ જેથી AFL બધા કાયદાકીય અને નિયમનકારી નિર્દેશોનું પાલન કરી શકે। ૧૭. હું/અમે AFL ને પરવાનગી આપું છું/અપીએ છીએ કે મારી/અમારી સંબંધિત માહિતી RBI, કર વિભાગ, ક્રેડિટ બ્યુરો, તૃતીય પક્ષો, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, TransUnion CIBIL, અથવા અન્ય સત્તાધિક સંસ્થાઓ સાથે શેર કરી શકે અથવા ત્યાંથી માહિતી મેળવી શકે।૧૮. હું/અમે સંમતિ આપું છું/અપીએ છીએ કે - (ક) CIBIL અથવા અન્ય સત્તાધિક એજન્સીઓ AFL દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રોસેસ કરી શકે, અને (ખ) તે માહિતી અથવા તેમાંથી તૈયાર કરેલા પ્રોડક્ટ્સ બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને અન્ય ક્રેડિટ પ્રદાનકારો સાથે વહેંચી શકે।૧૯. હું/અમે AFL ને 2016 ના Insolvency and Bankruptcy Code હેઠળ પોતાના અધિકારો અમલમાં મુકવા, લોનનું મોનીટરીંગ કરવા અને વસૂલી માટે જરૂરી પગલાં લેવા મંજૂરી આપું છું/અપીએ છીએ।૨૦. હું/અમે AFL ને મંજૂરી આપું છું/અપીએ છીએ કે તે મારી/અમારી સાથે લોન, બાકી રકમ, માર્કેટિંગ યોજનાઓ કે અન્ય નાણાકીય/વોમા ઉત્પ



રિટેલ લેણદારો માટે શુલ્કનું શેડ્યૂલ

૧ એપ્રિલ, ૨૦૨૫થી અમલમાં આવશે

ફી અને શુલ્ક	માલમત્તા સામે ધિરાણ (LAP) અને સૂક્ષ્મ માલમત્તા સામે ધિરાણ (MLAP)	ગૃહ ધિરાણ (HL) અને પરવડે તેવો ગૃહ ધિરાણ યોજના (AHL)	બિઝનેસ લોન	વ્યક્તિગત લોન	શિક્ષણ લોન		
લોન અરજી શુલ્ક	સામાન્ય ગૃહ ધિરાણ અને માલમત્તા સામે ધિરાણ (LAP) માટે – Rs. 5,000/- + લાગુ પડતા કર પરવડે તેવો ગૃહ ધિરાણ યોજના અને સૂક્ષ્મ માલમત્તા સામે ધિરાણ (MLAP) માટે – Rs. 2,500/- + લાગુ પડતા કર		શૂન્ય				
લોન પ્રોસેસિંગ શુલ્ક	સામાન્ય ગૃહ ધિરાણ અને માલમત્તા સામે ધિરાણ (LAP) માટે - વધુમાં વધુ ૨% + લાગુ પડતા કર પરવડે તેવો ગૃહ ધિરાણ યોજના અને સૂક્ષ્મ માલમત્તા સામે ધિરાણ (MLAP) માટે - વધુમાં વધુ ૩% + લાગુ પડતા કર		લોનની રકમના વધુમાં વધુ ૩% + લાગુ પડતા કર				
આંશિક પૂર્વ ચુકવણી (લાગુ પડતી હોય તો)	લાગુ પડતા શુલ્ક ફ્લોટિંગ વ્યાજ દર હેઠળના લોન માટે: 1. જો મુખ્ય અરજીકર્તા નોન-ઇન્ટરવિજ્યુઅલ હોય (ગૃહ ધિરાણ, LAP, માઇક્રો LAP અને પરવડે તેવો ગૃહ ધિરાણ માટે) 2. જો મુખ્ય અરજીકર્તા વ્યક્તિગત હોય અને અંતિમ ઉપયોગ વ્યવસાય માટે હોય (ગૃહ ધિરાણ અને પરવડે તેવો ગૃહ ધિરાણ લોન સિવાય) માલમત્તા સામે લોન અને માઇક્રો LAP માટે - ૩% + લાગુ પડતા કર ગૃહ ધિરાણ અને પરવડે તેવો ગૃહ ધિરાણ માટે - ૨% + લાગુ પડતા કર ફિક્સડ વ્યાજ દર હેઠળના લોન માટે - ૪% + લાગુ પડતા કર આંશિક પૂર્વ ચુકવણી અને પૂર્વસમાપ્તિ માટે લાગુ પડતા શરતો: 1. આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ ફક્ત 12 EMI ની સફાઈ પછી જ મંજૂર થશે. 2. આંશિક પૂર્વ ચુકવણી ફક્ત આર્થિક વર્ષમાં બે વખત મંજૂર થશે અને વર્ષ દરમિયાન POS ની વધુમાં વધુ 25% જ સ્વીકાર્ય હશે. 3. આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ તરીકે પ્રાપ્ત રકમ મુખ્ય બાકી રકમ અને આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ શુલ્ક સામે સંતુલિત કરવામાં આવશે. 4. કોઈપણ આંશિક પૂર્વ ચુકવણી માટે સમાયોજિત કરાવેલ રહેશે માત્ર સમયગાળા (Tenure) માં, અને EMI ની રકમ જ સમાન રહેશે. (EMI સમયગાળો ઘટશે, EMI રકમ સ્થિર રહેશે) *વ્યક્તિગત લોનગ્રાહકો માટે, જોઈએ તો અંતિમ ઉપયોગ વ્યવસાય સિવાયનો હોય, ફ્લોટિંગ વ્યાજ દર હેઠળ લોન પર પૂર્વ ચુકવણી અને પૂર્વસમાપ્તિ શુલ્ક અને શરતો લાગુ નહીં પડશે.		લાગુ પડતા શુલ્ક - ૪% + લાગુ પડતા કર આંશિક પૂર્વ ચુકવણી અને પૂર્વસમાપ્તિ માટે લાગુ પડતા શરતો: 1. આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ ફક્ત 12 EMI ની સફાઈ પછી જ મંજૂર થશે. 2. આંશિક પૂર્વ ચુકવણી ફક્ત આર્થિક વર્ષમાં બે વખત મંજૂર થશે અને વર્ષ દરમિયાન POS ની વધુમાં વધુ 25% જ સ્વીકાર્ય હશે. 3. આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ તરીકે પ્રાપ્ત રકમ મુખ્ય બાકી રકમ અને આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ શુલ્ક સામે સંતુલિત કરવામાં આવશે. 4. કોઈપણ આંશિક પૂર્વ ચુકવણી માટે સમાયોજિત કરાવેલ રહેશે માત્ર સમયગાળા (Tenure) માં, અને EMI ની રકમ જ સમાન રહેશે. (EMI સમયગાળો ઘટશે, EMI રકમ સ્થિર રહેશે)	લાગુ પડતા શુલ્ક - ૩% + લાગુ પડતા કર આંશિક પૂર્વ ચુકવણી અને પૂર્વસમાપ્તિ માટે લાગુ પડતા શરતો: 1. આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ ફક્ત 12 EMI ની સફાઈ પછી જ મંજૂર થશે. 2. આંશિક પૂર્વ ચુકવણી ફક્ત આર્થિક વર્ષમાં બે વખત મંજૂર થશે અને વર્ષ દરમિયાન POS ની વધુમાં વધુ 25% જ સ્વીકાર્ય હશે. 3. આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ તરીકે પ્રાપ્ત રકમ મુખ્ય બાકી રકમ અને આંશિક પૂર્વ ચુકવણી / પૂર્વસમાપ્તિ શુલ્ક સામે સંતુલિત કરવામાં આવશે. 4. કોઈપણ આંશિક પૂર્વ ચુકવણી માટે સમાયોજિત કરાવેલ રહેશે માત્ર સમયગાળા (Tenure) માં, અને EMI ની રકમ જ સમાન રહેશે. (EMI સમયગાળો ઘટશે, EMI રકમ સ્થિર રહેશે)			
સીઇઆરએઆઇ (CERAI) શુલ્ક	રૂ. ૧૦૦		રૂ. ૧૦૦ (સુરક્ષિત લોન માટે)	લાગુ નથી			
બાઉન્સ ચાર્જિસ (ચેક રિટર્ન / NACH (એનએસીએચ) નિષ્ફળતા)	રૂ. ૫૦૦ પ્રતિ બાઉન્સ						
દસ્તાવેજ શુલ્કો(ખાતાનું નિવેદન / ફોરવોર્ડર લેટર / ચુકવણીનું શેડ્યૂલ / વ્યાજ પ્રમાણપત્ર / બેલેન્સ રેકૉર્ડ / દસ્તાવેજોની સુવિ / કોઈ ડ્યુર પ્રમાણપત્ર નહીં)	શૂન્ય						
દસ્તાવેજ પુનઃપ્રાપ્તિ શુલ્ક	રૂ. ૫૦૦ પ્રતિ દસ્તાવેજ						
પીડીસી (PDCs), સિક્યોરિટી ચેક્સ, એનએસીએચ (NACH) સ્વેપ ચાર્જ	રૂ. ૫૦૦ પ્રતિ ઇન્સ્ટેન્સ						
ફ્લોટિંગ ROI (આર.ઓ.આઈ) હેઠળ લોન ફરીથી શેડ્યુલિંગ/ ફરીથી કિંમત નિર્ધારણ (ગ્રાહકની વિનંતી પર અને AFL (એએફએલ) ન							